



ધી અર્બન હેલ્થ સોસાયટી, વડોદરા  
એન.એચ.એમ પ્રોગ્રામ  
વડોદરા મહાનગરપાલિકા  
www.vmc.gov.in

**ભરતી અંગેની જાહેરાત**

વડોદરા મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસનાં કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે બ્લોક ફાઇનાન્સ આસિસ્ટન્ટની એક (બિ.એ.-૧) જગા ભરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે [www.vmc.gov.in](http://www.vmc.gov.in) વેબસાઇટ પર તા. ૧૧/૦૪/૨૦૧૮ (૦૦.૦૧ કલાક) થી તા. ૨૫/૦૪/૨૦૧૮ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. (૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ [www.vmc.gov.in](http://www.vmc.gov.in) પરથી મેળવવાની રહેશે.

નોંધ:- ઉપરોક્ત જગા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજૂર જગા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ ૨ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.

ચેકઝક્યુટીવ કમીટી  
અને ડે.મ્યુનિસિપલ કમિશનર(આ)  
વડોદરા મહાનગરપાલિકા

પી.આર.ઓ. નં ૨૬/૧૮-૧૯



ધી અર્બન હેલ્થ સોસાયટી, વડોદરા  
એન.એચ.એમ પ્રોગ્રામ  
વડોદરા મહાનગરપાલિકા

સીધી ભરતી માટેની જાહેરાત

(જાહેરાત ક્રમાંક: ૨૬/૨૦૧૮-૧૯)

ક્રમ	જગ્યાનું નામ	જગ્યાની સંખ્યા	કેટેગરી
૧	બ્લોક ફાઇનાન્સ આસીસ્ટન્ટ	૦૧	સામાન્ય - ૦૧

1. શૈક્ષણિક લાયકાત અને અનુભવ

કોમર્સમાં સ્નાતક અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટીફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ. કોમ્પ્યુટર માં સોફ્ટવેર ( એકાઉન્ટીંગ, M.S.Office/GIS/RCH software વગેરે) અને હાર્ડવેરની જાણકારી હોવી જોઈએ. ઓફિસ વર્ક તેમજ ફાઇલીંગની મુળભુત જાણકારી હોવી જોઈએ. અંગ્રેજી તેમજ ગુજરાતીમાં ટાઇપીંગ તેમજ ડેટા એન્ટ્રી કરતા આવડવું જોઈએ. અનુભવ : ઓછામાં ઓછા ૩ વર્ષ

2. પગાર ધોરણ:

રૂ.૧૦,૦૦૦/- માસિક ફિક્સ પગાર

1. ઉંમર:

૫૮ વર્ષ થી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં

2. કરારનો સમયગાળો:

૧૧ માસના કરાર આધારીત

જાહેરાતની સામાન્ય જોગવાઈઓ:

- ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
- રસ ધરાવતા ઉમેદવારોએ તા . ૧૧ /૦૪/૨૦૧૮ (૦૦-૦૧ કલાક) થી તા. ૨૫/૦૪/૧૮ (૨૩-૫૯ કલાક) દરમિયાન [www.vmc.gov.in](http://www.vmc.gov.in) વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે . ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ [www.vmc.gov.in](http://www.vmc.gov.in) ઉપરથી વાંચી લેવાની રહેશે.

3. **શૈક્ષણિક માહિતી:** શૈક્ષણિક માહિતી જો સામેલ Education Qualification Details માં ન હોય તો OTHER1 અને કોમ્પ્યુટર કોર્સ ની માહિતી OTHER2 માં ભરવી.
4. **અનામત:** ગુજરાત સરકારશ્રી દ્વારા માન્ય કરેલ હોય તેવા અનુ.જાતિ , અનુ.જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે આ અંગે ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઇશ્યુ કરાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
5. **વયમર્યાદા:** અરજી સ્વીકારવાની તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.
6. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉચ્ચત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૦૯-૦૨-૧૯૯૬ ના ઠરાવ થી નિયત થયેલ પરિશિષ્ટ-ક ના નમુનામાં નાણાકીય વર્ષ-૨૦૧૬-૨૦૧૭ નું તા.૦૧-૦૪-૨૦૧૬ પછીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
7. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે.
8. ઉમેદવારે અરજીમાં દર્શાવેલ કેટેગરીમાં પાછળથી કેટેગરી બદલવાની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
9. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલ હોવો જોઈએ.
10. ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
11. ઉમેદવારે અરજી પત્રકમાં કોઈ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે.
12. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
13. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/ મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
14. આ જાહેરાત કોઈ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
15. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈ સુચના માટે [www.vmc.gov.in](http://www.vmc.gov.in) વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

તા. ૧૦/૦૪/૨૦૧૮

**ચેરમેન**  
એક્ઝિક્યુટીવ કમિટી, અર્બન હેલ્થ સોસાયટી,  
અને ડે.મ્યુનિસિપલ કમિશ્નરશ્રી  
વડોદરા મહાનગરપાલિકા